

RAN-2508000605050001
T.Y.B.Com. (Sem.-V) Examination March - 2026
SEC - Mobile Banking
Time: 1 Hour]
[Total Marks: 25

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. ટૂંકમાં જવાબ આપો. (7 માંથી કોઈપણ 5) (10)**
- મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
 - મોબાઈલ બેન્કિંગનો અર્થ સમજાવો.
 - મોબાઈલ બેન્કિંગ સામેના અવરોધો જણાવો.
 - મોબાઈલ બેન્કિંગમાં નાણાંકીય સાક્ષરતાનું મહત્વ શું છે?
 - UPI શું છે?
 - બે-ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે શું?
 - કોર મોબાઈલ બેન્કિંગ સેવાઓના ઉદાહરણ આપો.
- પ્ર.2. વર્તમાન સમયમાં ભારતમાં મોબાઈલ બેન્કિંગની ભૂમિકા સમજાવી, (15)**
ભારતમાં મોબાઈલ બેન્કિંગ સેવા અપનાવવાને અસર કરતા પરિબળો સમજાવો.
અથવા
- પ્ર.2. (અ) મોબાઈલ બેન્કિંગનું મહત્વ સમજાવો. (8)**
પ્ર.2. (બ) ભારતમાં કોર મોબાઈલ બેન્કિંગ સેવાનો આર્થિક ક્ષેત્રે પ્રભાવ સમજાવો. (7)

ENGLISH VERSION

- Q.1. Brief answers (any 5 out of 7) (10)**
- State the difference between mobile banking and internet banking.
 - Explain the meaning of mobile banking.
 - Describe the barriers of mobile banking.
 - What is the importance of financial literacy in mobile banking?
 - What is UPI?
 - What is Two-factor authentication?
 - Give the examples of core mobile banking services.
- Q.2. Explain the role of mobile banking in India in the present times. (15)**
Explain the factors affecting the adoption of mobile banking services in India.
OR
- Q.2. (A) Explain the importance of mobile banking. (8)**
Q2. (B) Explain the impact of core mobile banking services on the economic sector in India. (7)